

## --:અખબારી યાદી:-

# ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત અને જાહેરમાં કચરો ફેંકતા આસામીઓને દંડ કરવાની કામગીરી

મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીએ પણ અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝીટ કરી થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું

તારીખ:- ૧૧-૦૧-૨૦૧૯

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી તારીખ: ૧૧-૦૧-૨૦૧૯ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા ત્રણેય ઝોનમાં સાધન કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન મ્યુનિ. કમિશનરશ્રી બંધાનિધિ પાનીએ પણ અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઈઝ વિઝીટ કરી થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતી.

## સેન્ટ્રલ ઝોન

મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કુલ - ૯૪ આસામીઓ પાસેથી ૧૪ કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટિક તથા રૂ/- ૪૨,૦૪૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરશ્રી નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઈ જીજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડશ્રી એચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

## ઈસ્ટ ઝોન

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ધ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ને અનુલક્ષીને વાણિજ્ય વિસ્તારો તથા માર્ગોમાં સફાઈની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર તથા વાણિજ્ય વિસ્તારના દુકાનદારો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે તથા વાણિજ્ય વિસ્તારની તેમની દુકાનોની આસપાસ સ્વચ્છતા જળવાય રહે તે માટે પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં આજરોજ તા. ૧૧-૧-૨૦૧૯ને રોજ પુર્વ ઝોનની

તમામ ટીમ ધ્વારા વાણિજ્ય વિસ્તારોમાં ઝુંબેશરૂપે ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા આસામીઓ પાસેથી વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. જેની વિગતો નીચે પ્રમાણે છે.

ક્રમ. નં.	વાણિજ્ય વિસ્તારનું નામ	વસુલેલ વહીવટી ચાર્જ. રૂ.	આસામીની સંખ્યા
૧	કુવાડવા રોડ	૮૫૦૦/-	૨૭
૨	સંતકબિર રોડ	૮૫૮૫/-	૨૭
૩	ન્યુ આશ્રમ રોડ	૭૫૦/-	૩
૪	ભાવનગર રોડ	૨૫૦૦/-	૧૦
૫	કોઠારિયા રોડ	૭૨૩૪/-	૧૭
	કુલ	૨૭૫૬૯/-	૮૪

આ કામગીરી દરમિયાન નવ (૯) કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે.

ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના આસિ. કમિશ્નરશ્રી વિ. એસ. પ્રજાપતિ, વોર્ડ એન્જીનીયરશ્રીઓ, વોર્ડ ઓફિસરશ્રીઓ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા, તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી પ્રકુલ ત્રીવેદી, શ્રી એન. એમ, જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, શ્રી અશ્વિન વાઘેલા, શ્રી પ્રશાંત વ્યાસ, શ્રી પ્રતિક રાણાવસિયા, શ્રી એ. એફ. પઠાણ શ્રી બી. જે, સોલંકી, શ્રી આર.જે.પરમાર તથા શ્રી જય ચૌહાણ ધ્વારા કરવામાં આવેલ હતી.

## વેસ્ટ ઝોન

વેસ્ટહ ઝોન ખાતે જાહેરમાં કચરો ફેંકી લીટરીંગ કરતા આસામી તેમજ દુકાનધારકો પાસે સફાઈ કરાવી વહીવટી ચાર્જ વસુલવાની કામગીરી

"સ્વવચ્છ ભારત મિશન" અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ધ્વારરા શહેર માં સ્વબચ્છ તા જળવાઈ રહે તે હેતુ થી માન. કમિશ્નરશ્રી દ્વારા જાહેરમાં કચરો ફેંકવા પર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.

જાહેરમાં કચરો ફેંકવા પર પ્રતિબંધ હોવા છતા વેસ્ટર ઝોન ખાતે ના નીચે દર્શાવેલ વિસ્તાધરોમા કચરો ફેંકવામાં આવતા આજ રોજ નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વોર્ડ નં.	કોમર્શિયલ એરીયા	વસુલ કરેલ વહીવટી ચાર્જ	આસામીની સંખ્યા	જપ્ત કરેલ પ્રતિબંધિત પ્લાસ્ટીક
૧	રૈયા ચોકડી થી આલાપગ્રીન સીટ સુધીનો રૈયા રોડ તથા રામાપીર ચોકડી	૨૩૦૦/-	૧૫	૧ કીલો
૮	(કાલાવડ રોડ) નકલંક યા થી કે.કે.વી ચોક સુધી	૫૪૦૧	૧૪	૧.૨ કીલો
૯	અેય પી. પેટ્રોલ પંમ્પ થી ગંગોત્રી ડેરી થઈ	૩૯૦૦	૧૬	૧.૫ કીલો

	આલાપ સુધી (સાધુ વાસવાણી રોડ)			
૧૦	(કાલાવડ રોડ) શક્તિ ટી સ્ટોીલ થી અેજી. ચોક સુધી તથા પંચાયત ચોક	૧૬૩૭૪/-	૩૦	૧.૩ કીલો
૧૧	બાલાજી હોલ સર્કલ નાનામવા રોડ (૧૫૦ ફીટ રોડ)	૬૮૦૧/-	૨૪	૦.૫ કીલો
૧૨	(મવડી રોડ)મવડી ચોકડી થી સહયોગ હોસ્પીટલ સુધી ઉમીયા ચોક (૧૫૦ ફીટ રીંગ રોડ),	૫૪૩૪/-	૧૯	૦.૫ કીલો
કુલ :-		૪૦૨૧૦/-	૧૧૮	૬ કીલો

ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્ન સાહેબશ્રી બંછા નિધી પાનીના આદેશ અન્વયે વેસ્ટ ઝોન નાયબ કમિશ્નર જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ વેસ્ટપ ઝોનના આસી. કમિશ્ન સમીર ઘડુક, હારૂન દોઢીયા(સીટી ઇજનેર) નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની હાજરીમાં વોડ વાઇઝ સેનેટરી ઇન્પેચે કટર તથા વોર્ડ ઓફીસર ની ટીમો મારફત મદદનીશ ઇજનેર રાકેશ શાહ તથા ભાવેશ ખાંભલાની હાજરીમાં વેસ્ટબ ઝોન ના વોર્ડ ઓફીસર નીલમબેન, ઘવલભાઇ, સુનીશાબેન, રાજેસભાઇ, કાનાણીભાઇ, કિંઝલબેન, તથા એસ.આઇ પીયુષ ચૌહાણ, કેતન લખતરીયા, મૌલેષ વ્યાેસ, સંજય દવે, મનોજ વાઘેલા, ધામેયાભાઇ તથા એસ.એસ.આઇ મયુર પરનાલીયા , સંજય ચાવડા, ભાવેશ ઉપાધ્યાય, વિશાલભાઇ, ગૌતમભાઇ મયુરભાઇ, ઉદયસિંહ, નીલેશભાઇ, વિમલભાઇ, નીતીનભાઇ ભાવનાબેન ગોસાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(જન સંપર્ક અધિકારી)  
રાજકોટ મહાનગરપાલિકા